

20th Meeting of Indian Ocean Rim Association Council of Ministers

December 17, 2020

હિન્દ મહાસાગર કિનારા સંગઠનની મંત્રીઓની પરિષદની 20મી બેઠક

ડીસેમ્બર 17, 2020

1. રાજ્ય કક્ષાનાં વિદેશ મંત્રી શ્રી વી. મુરલીધરને 17 ડીસેમ્બર 2020 નાં રોજ IORA નાં અધ્યક્ષ યુએઈ દ્વારા વર્ચુઅલી યોજવામાં આવેલી હિન્દ મહાસાગર કિનારા સંગઠન (IORA) ની મંત્રીઓની પરિષદ (COM) ની 20મી બેઠક પર ભારતીય પ્રતિનિધિમંડળની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં તમામ 22 સભ્ય રાજ્યો અને 10 સંવાદ ભાગીદારોની હાજરી રહી હતી. આ બેઠકમાં IORA સભ્ય રાજ્યો દ્વારા સામાન્ય હિતનાં વિવિધ પ્રાંતિય તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર મનોમંથન કર્યું હતું. COM દ્વારા એમિરાતોની સત્તાવાર યાદી અને કોવિડ-19 તરફનાં પ્રતિભાવમાં IORA ની ઐક્યતા અને સહકારનું નિવેદન ગ્રહણ કરવામાં આવ્યા હતા.

2. પોતાની ટિપ્પણીઓમાં, રાજ્ય કક્ષાનાં મંત્રીએ હિન્દ મહાસાગર પ્રાંતમાં અને બૃહદ ઈન્ડો-પેસિફિકમાં પ્રાંતિય સહકાર માટે એક મંચ તરીકે IORA ની અગત્યતા પર પ્રકાશ પાડ્યો હતો. તેણે આપત્તિ જોખમ વ્યવસ્થાપન અને શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી નામનાં IORA નાં બે પ્રાથમિકતાનાં ક્ષેત્રોમાં સંકલનકર્તા દેશ તરીકે ભારત દ્વારા કરવામાં આવેલા યોગદાનોની નોંધ લીધી હતી. મહામારી-બાદની વ્યાપક રીકવરીને દ્રષ્ટિકોણમાં રાખતા, રાજ્ય કક્ષાનાં મંત્રીએ IORA સભ્ય રાજ્યોમાં પરંપરાગત દવાઓ અને સુખાકારી પ્રવાસનનાં ક્ષેત્રમાં વધારે સહકાર માટે આલ્વાન કર્યું હતું. IORA વધારે મજબૂત કરવા તરફની ભારતની કટિબદ્ધતાને આગળ લઈ જતા, રાજ્ય કક્ષાનાં મંત્રીએ IORA સચિવાલયમાં ભારત દ્વારા આઈટી નિષ્ણાંતને કાર્યરત કરવાની નોંધ લીધી હતી અને વધુમાં IORA સચિવાલય પર ઈ-ઓફિસ પ્રણાલીનાં અમલીકરણનાં સ્વરૂપમાં ભારતની પહેલ અને મહાત્મા ગાંધી પુસ્તકાલયની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.

3. IORA નાં સ્થાપના સભ્ય તરીકે ભારત 1997 માં તેની અવધારણાનાં સમયથી જ તેની વૃદ્ધિ તરફ કટિબદ્ધ રહ્યો છે. 2011 માં IORA માં ભારતની અધ્યક્ષતા દરમિયાન, IORA દ્વારા તેનાં છ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો ગ્રહણ કરવામાં આવ્યા હતા જે તેની તમામ મુખ્ય પ્રવૃત્તિઓનાં માર્ગદર્શક સિદ્ધાંતો છે. વધારે આંતર-પ્રાંતિય ભાગીદારી મારફત ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિનાં પ્રચાર માટે ભારત IORA ને એક અનન્ય મંચ તરીકે જુએ છે.

નવી દિલ્હી

ડીસેમ્બર 17, 2020

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.